

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

(૧) ઓન-લાઇન અરજીપત્રકોના રજીસ્ટ્રેશન અંગેની સુધારા જાહેરાત

( જાહેરાત ક્રમાંક: ૧૪૦/૨૦૧૭૧૮ - નર્સિંગ ટ્યુટર )

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સચિવાલયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નિયંત્રણ હેઠળના ખાતાના વડા અધિક નિયામકશ્રી, આરોગ્ય, ગાંધીનગર હસ્તકની નર્સિંગ ટ્યુટર, વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની તા. ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સંયુક્ત જા.ક. ૧૩૮/૨૦૧૭૧૮ થી ૧૪૧/૨૦૧૭૧૮ પૈકીમાં જા.ક. ૧૪૦/૨૦૧૭૧૮, નર્સિંગ ટ્યુટર સંવર્ગની પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી. જેમાં ઓન-લાઇન અરજીપત્રકોના રજીસ્ટ્રેશન સમય દરમિયાન જે ઉમેદવારો અગાઉથી સરકારી સેવામાં ફરજ બજાવતા હતા તેવા ઉમેદવારોએ નર્સિંગ ટ્યુટર સંવર્ગમાં તેઓને ઉપલી વય મર્યાદા લાગુ પડતી નથી તેમ છતાં ઓન-લાઇન અરજીપત્રકોના રજીસ્ટ્રેશન પ્રોગ્રામમાં ઉપલી વય મર્યાદા અન્ય ઉમેદવારોની જેમ ૪૫ વર્ષની રાખેલ હોવાથી તેઓ ઓન-લાઇન અરજીપત્રક રજીસ્ટર્ડ કરાવી શકતા ન હોવાથી સરકારી સેવામાં ફરજ બજાવતા ઉમેદવારો માટે પ્રોગ્રામમાંથી ઉપલી વય મર્યાદા દૂર કરવા રજુઆત કરતાં તે અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ ખાતાના વડાની કચેરીના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી આ બાબતે જરૂરી અભિપ્રાય આપવા જણાવવામાં આવેલ હતું. જે અન્વયે ખાતાના વડા નાયબ નિયામકશ્રી (નર્સિંગ) તબીબી સેવાઓ, ગાંધીનગરે તેમના તા. ૦૫/૦૧/૨૦૧૮ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા. ૦૮/૦૮/૨૦૧૮ ના પત્રથી અભિપ્રાય આપેલ છે. જે અનુસાર અગાઉથી ગુજરાત સરકારની સેવામાં હોય તેવા ઉમેદવારોને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવાની થાય છે.

આ સંવર્ગની તા. ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ કરેલ જાહેરાત અન્વયે સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તેવા ઉમેદવારો વય મર્યાદાના કારણે અરજીપત્રકો રજીસ્ટર્ડ કરાવી શકેલ નથી તેવા ઉમેદવારો ઓન-લાઇન અરજીપત્રકો રજીસ્ટર્ડ કરી શકે તે માટે ઉક્ત જા.ક. ૧૪૦/૨૦૧૭૧૮ - નર્સિંગ ટ્યુટર રી-ઓપન કરવામાં આવેલ છે. અને તે અનુસાર ઉમેદવારો તા. ૧૩/૦૮/૨૦૧૮ ના રોજ બપોરના ૧૪-૦૦ કલાકથી તા. ૧૮/૦૮/૨૦૧૮ રાત્રિના ૨૩-૫૯ કલાક દરમિયાન ઓજસની વેબ સાઇટ <https://www.ojas.gujarat.gov.in> પર અરજીપત્રક રજીસ્ટર્ડ કરી શકશે.

- (૧) મુળ જા.ક. ૧૪૦/૨૦૧૭૧૮ - નર્સિંગ ટ્યુટર અન્વયે જે ઉમેદવારો અગાઉથી સરકારની સેવામાં હોય અને ઉપલી વય મર્યાદાના કારણે ઓન-લાઇન અરજીપત્રક રજીસ્ટર્ડ કરાવી શકેલ નથી તેવા સરકારી સેવામાં ફરજ બજાવતા ઉમેદવારો ( વિધિસરની ભરતી પ્રક્રિયાથી સરકારી સેવામાં નિમણૂક પામેલ કર્મચારીઓ) જ આ રી-ઓપન કરેલ જાહેરાત અન્વયે પોતાનું અરજીપત્રક

રજીસ્ટર્ડ કરાવી શકશે. તે સિવાય અન્ય કોઈ ઉમેદવારો પોતાનું અરજીપત્રક રજીસ્ટર્ડ કરાવી શકશે નહીં.

- (૨) રી-ઓપન કરેલ ઉક્ત જાહેરાત અનુસાર ઓન-લાઇન અરજીપત્રક ભરવાની છેલ્લી તા. ૧૮/૦૮/૨૦૧૮ રાત્રિના ૨૩-૫૯ કલાક સુધીની રહેશે. અને જનરલ કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ - ૨૦/૦૮/૨૦૧૮ (૧૭-૦૦ કલાક) સુધીની રહેશે.
- (૩) શા.શૈ.પ. વર્ગના ઉમેદવારો માટે નોન-ક્રીમીલેયર સર્ટી (પરિશિષ્ટ - ૪ ના ગુજરાતી નમૂના મુજબ) સર્ટિફિકેટ તા. ૦૧/૦૪/૨૦૧૬ થી તા. ૧૮/૦૮/૨૦૧૮ ( ૩૧/૩/૨૦૧૬, ૩૧/૦૩/૨૦૧૭, ૩૧/૦૩/૨૦૧૮ ના રોજ પુરા થયેલ નાણાંકીય વર્ષ ૨૦૧૫-૨૦૧૬ / ૨૦૧૬-૨૦૧૭ / ૨૦૧૭-૨૦૧૮ માટેનું ) દરમ્યાન મેળવેલ હોય તેવું પ્રમાણપત્ર ધરાવતા હશે તો જ તેને માન્ય ગણવામાં આવશે અને તે અન્વયે કેટેગરીની અનામત જગ્યાનો લાભ મળી શકશે.
- (૪) ઉપર વર્ણવેલ મુદ્દાઓ સિવાય વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય તમામ બાબતો માટે તા. ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ મૂળ જાહેરાતમાં વર્ણવ્યા મુજબની સૂચનાઓ અને શરતો યથાવત રહેશે. (જાહેરાતમાં દર્શાવેલ તમામ કેટેગરીના ઉમેદવારોનાં કિસ્સામાં શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય જરૂરી લાયકાત માટેની નિયત **CUT OFF DATE** તા. ૧૨/૧૧/૨૦૧૭ સહિત)

સ્થળ:- ગાંધીનગર  
તારીખ- ૦૮/૦૮/૨૦૧૮

સચિવ  
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર

# ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

## (૨) અગત્યની જાહેરાત

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા તાંત્રિક સંવર્ગોની સીધી ભરતી માટે તા. ૧૭/૧૦/૨૦૧૭ ના રોજ પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક: ૧૪૦/૨૦૧૭૧૮ અને તા. ૦૮/૦૮/૨૦૧૮ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ સુધારા જાહેરાત ૧૪૦/૨૦૧૭૧૮ અન્વયે ઉમેદવારો તરફથી રજીસ્ટર્ડ થયેલ અરજીપત્રકોની પ્રાથમિક ચકાસણી ( એક કરતાં વધુ અરજી કરેલ છે કે કેમ ? અને General કેટેગરીના ઉમેદવારોએ પરીક્ષા ફી ભરેલ છે કે કેમ ?) ને અંતે લાયક ગણવાપાત્ર ઉમેદવારોની જાહેરાતમાં વર્ણવ્યા મુજબની પ્રથમ તબક્કાની MCQ - OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી ગાંધીનગર ખાતેના જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર યોજવાનો મંડળ દ્વારા નિર્ણય કરવામાં આવેલ છે. જેની વિગતો નીચે દર્શાવ્યા મુજબ છે. અનિવાર્ય કારણોસર આ કાર્યક્રમમાં મંડળ ફેરફાર કરી શકશે.

અ.નં.	જાહેરાત ક્રમાંક	સંવર્ગનું નામ	પરીક્ષાની તારીખ
૧	૧૪૦/૨૦૧૭૧૮	નર્સિંગ ટ્યુટર	૦૮/૦૮/૨૦૧૮ (MCQ- OMR પદ્ધતિની સ્પર્ધાત્મક લેખિત કસોટી )

સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાનો સમય તથા કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ તેમજ રદ થયેલ અરજીપત્રકોની વિગતો (પરીક્ષા ફી ન ભરવાના કારણસર અને એક કરતાં વધુ અરજી કરેલ હોય તેવા કિસ્સામાં છેલ્લે કન્ફર્મ થયેલ અરજીપત્રક ગ્રાહ્ય રાખીને બાકીના અરજીપત્રકો ડુપ્લીકેશનના કારણસર રદ ગણવાના થાય છે તેવા) પરીક્ષાની તારીખના ૧૦ દિવસ પહેલાં મંડળની વેબસાઇટ <https://gsssb.gujarat.gov.in> પર મુકવામાં આવશે. જેની સંબંધિત દરેક ઉમેદવારોએ જરૂરી નોંધ લેવા તેમજ મંડળની વેબસાઇટ જોતા રહેવા આથી જણાવવામાં આવે છે.

સ્થળ:- ગાંધીનગર  
તા. ૦૮/૦૮/૨૦૧૮

સચિવ  
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ  
ગાંધીનગર